

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫
ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૩૮/૨૦૧૬

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૮/૨૦૧૬

વાદી:-

છીપા આરીફહુસેન અબ્દુલસતાર,
૫ ગંગા જમાના સોસાયટી,
દાણીલીમડા અમદાવાદ

વિરુદ્ધ

પ્રતિવાદી:-

- (૧) આર.ટી.ઓ. અધિકારીશ્રી,
આર.ટી.ઓ. અધિકારીશ્રીની કચેરી,
અમદાવાદ
- (૨) મદદનીશ વેટ કમિશનરશ્રી,
વેટ કમિશનરશ્રીની કચેરી,
વાણિજ્ય વેરા ભવન,
આશ્રમ રોડ, અમદાવાદ

વિષય:- વાહનનો વેટ ટેક્સ ન સ્વીકારવા બાબત.

અરજદારશ્રી છીપા આરીફ હુસેન અબ્દુલ સતાર

શ્રી છીપા આરીફહુસેન અબ્દુલસતારે તા. ૨૨/૦૩/૨૦૧૬ ની અરજીથી રજૂઆત કરેલ છે કે, તેઓની રાજ્ય ગાંધી ફાઉન્ડેશન, નવી દિલ્હી મારફતે સ્પેશ્યલ ડિઝાઇન વ્હીકલ મહેન્દ્રા રોડીયો સ્કુટર વીથ ડીસેબલ મોડીફિકેશન કીટ તા.૨૨/૮/૨૦૧૬ ના રોજ મળેલ છે.

૨. પ્રસ્તુત સ્કુટર તેઓને રાજ્ય ગાંધી ફાઉન્ડેશન ધ્વારા મફતમાં મળેલ છે તેઓએ નવી દિલ્હી ખાતે આર.ટી.ઓ. ટેક્સ પેટે રૂ.૫૦૪૮/- ભરેલ છે. પ્રસ્તુત વાહન તેઓ

અમદાવાદ લાવતા તા.૭/૯/૧૫ના રોજ વસ્રાલ આર.ટી.ઓ અધિકારીને મળીને રજીસ્ટ્રેશન ફી રૂ. ૩૨૦/- ભરેલ છે. તા.૮/૯/૧૫ના રોજ બી.ટી.એ. તરીકે લેવાતી ફી રૂ.૧૫૦/- તથા નંબર પ્લેટના રૂ.૧૫૦/- ભરેલ છે તેમ છતાં આર.ટી.ઓ. ઓફિસ ધ્વારા તેમને વાહન નંબર ફાળવેલ નથી, જેના સંદર્ભમાં આ કચેરીને તા.૨૨/૩/૨૦૧૬ થી અરજી કરતાં ફરિયાદ કેસ નં. ૫૩૮/૨૦૧૬ તરીકે નોંધણી કરી તા.૧૨/૩/૨૦૧૬ના રોજ મુદત રાખવામાં આવેલ. મુદતે વાદી અને પ્રતિવાદી આર.ટી.ઓ. કચેરી તરફથી શ્રી જી.જી.યુડાસમા મોટર વાહન નિરીક્ષક વસ્રાલ હાજર રહેલ.

૩. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં વેટ ૧૨ ટકા છે અને ગુજરાતમાં ૧૫ ટકા છે જેના કારણે ૩ ટકાનો તફાવતનો વેટ ભરવા તૈયાર છે, પરંતુ વેટનું ચલન બેંક ધ્વારા સ્વીકારવામાં આવતું નથી. વેટ કમિશનરશ્રીની ઓફિસમાં વેટ સ્વીકારવાની ના પાડતાં આર.ટી.ઓ. અધિકારીશ્રી ધ્વારા એવું કહેવામાં આવ્યું કે વેટ નહિ ભરાય ત્યાં સુધી ફાઇલ આગળ ચાલશે નહીં જેના કારણે અમને મુશ્કેલી પડતા આ કોર્ટ ધ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી શ્રી શેખે રજૂઆત કરેલ.

૪. મોટર વાહન નિરીક્ષકશ્રીએ મુદત દરમિયાન જણાવેલ કે આરીફ હુસેન શેખને વેટ ટેક્ષની તફાવતની રકમ બેંકમાં ભરવા માટે ફોર્મ ભરવા તથા વેટ ટેક્ષ કચેરીની કાર્યવાહી કરાવી આપશે.જે ધ્યાને લઈ હવે પછી ૧૦ દિવસની પુનઃ મુદત આપી તા.૨૨/૩/૨૦૧૬ ના રોજ મુદત રાખવામાં આવેલ. તા.૨૨/૩/૨૦૧૬ ના રોજ અરજદાર અને પ્રતિવાદી હાજર રહેલ નથી. પુનઃ તા.૨૮/૬/૨૦૧૬ ના રોજ મુદતે પ્રતિવાદી હાજર રહેલ નથી જેથી વેટ કમિશનરશ્રી અમદાવાદને હાજર રહેવા જણાવવામાં આવેલ. તા.૧૨/૭/૨૦૧૬ ની મુદતે શ્રી આરીફ હુસેન ધ્વારા જણાવવામાં આવેલ કે, તેઓ વેટ ઓફિસમાં વેટ ભરવા ગયા હતાં પરંતુ તેઓનો વેટ ટેક્ષ સ્વીકારવામાં આવેલ નથી. જેના કારણે જેના કારણે વાહનનું રજીસ્ટ્રેશન થઈ શકેલ ન હતું.

પ. તા.૧૨/૭/૨૦૧૬ અને તા.૨૭/૬/૨૦૧૬ની મુદત દરમ્યાન વાણિજ્ય વેરા કમિશનરશ્રીની કચેરી તરફથી શ્રી મનિષકુમાર જોષી હાજર રહેલ તેઓએ જણાવેલ કે, અરજદારે વેટ તફાવતની રકમ ભરી દીધેલ છે. જેથી અરજદાર ના વાહનનું રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે તે સંજોગોમાં આ બાબતે હવે વિશેષ કાર્યવાહી કરવાની રહેતી નથી.

૬ ઉપરોક્ત હકીકતે પ્રસ્તુત કેસમાં હું નીચેના તારણ ઉપર આવું છું અરજદારશ્રી આરીફ હુસેન દિવ્યાંગ છે. જો તે સમયે વાણિજ્ય વેરા નિરીક્ષક, વેટ કચેરી ધ્વારા માર્ગદર્શન આપેલ હોત તો, તેઓ તફાવતની રકમ ભરી શકાયા હોત અને તેઓ સમય સર વાહનનું રજીસ્ટ્રેશન કરાવી વાહનનો ઉપયોગ કરી શકયા હોત પરંતુ વેટ ટેક્ષ કચેરી અને આર.ટી.ઓ. કચેરી તરફથી અરજદારને સહયોગ નહીં મળતા અરજદારને હેરાન થવું પડેલ છે. જે ધ્યાને લઈ હું નીચે મુજબનો હુકમ કરું છું.

હુકમ

છીપા આરીફહુસેન અબ્દુલસતારની તા. ૨૨/૩/૨૦૧૬ ની રજૂઆત અન્વયે વાણિજ્ય વેરા કચેરી, તરફથી વેટ ટેક્ષની તફાવતની રકમ સ્વીકારવા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને તે અન્વયે હવે આર.ટી.ઓ. કચેરી અમદાવાદ ધ્વારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર ઇસ્યુ કરવામાં આવેલ છે. જેથી હવે તેઓની કોઈ ફરિયાદ રહેતી ન હોઈ, તેઓની અરજીનો નિકાલ કરવામાં આવે છે.

પ્રસ્તુત હુકમ સાથે હું કેસનો નિકાલ કરું છું.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) છીપા આરીફહુસેન અબ્દુલસતાર, ૫ ગંગા જમાના સોસાયટી, દાણીલીમડા અમદાવાદ
- (૨) આર.ટી.ઓ. અધિકારીશ્રી, આર.ટી.ઓ. અધિકારીશ્રીની કચેરી, અમદાવાદ
- (૩) મદદનીશ વેટ કમિશનરશ્રી, વેટ કમિશનરશ્રીની કચેરી, વાણિજ્ય વેરા ભવન, આશ્રમ રોડ, અમદાવાદ